

એસેસેમેન્ટ એન્ડ ટેક્ષ કલેક્શન ખાતુ

(દક્ષિણ પશ્ચિમ ઝોન)

-: કચેરીનું સરનામુ :-

વિભાગીય ડે.પ્યુનિસિપલ કમિશનરશ્રીની કચરી,

મહાનગર સેવા સદન,

દક્ષિણ પશ્ચિમ ઝોન-પ્રોપર્ટી ટેક્ષ વિભાગ,

જોધપુર ગ્રામ પંચાયત ઓફીસ,

રામજી મંદીરની બાજુમાં, પાણીની ટાંકી સામે,

જોધપુર ગ્રામ, અમદાવાદ - ૩૮૦ ૦૧૫.

માહિતી અધિકાર અધિનિયમ -૨૦૦૪

અંતર્ગત કલમ ૪(૧) માટે



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મહાનગર સેવા સદન, દક્ષિણ પશ્ચિમ ઓન - પ્રોપટી ટેક્ષ વિભાગ
જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજી મંદિરની બાજુમાં,
પાણીની ટાંકી સામે, જોધપુર ગામ, અમદાવાદ - ૩૮૦૦૧૫



એસેસમેન્ટ એન્ડ ટેક્ષ કલેક્શન ખાતું
દક્ષિણ પશ્ચિમ ઓન

દક્ષિણ પશ્ચિમ ઓન, વિભાગીય ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીની ક્યેરી
ઓફિસ:- જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજી મંદિરની બાજુમાં,
પાણીની ટાંકી પાસે, જોધપુર, અમદાવાદ-૩૮૦૦૧૫

પ્રોપટીટેક્ષ વિભાગ

| | | |
|--|-----------------|----------------|
| શ્રી મુકેશ બી. પટેલ (ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર) | (ઓફિસ) ૨૯૮૨૩૫૨૫ | મો. ૮૩૨૭૦૩૮૮૨૯ |
| શ્રી બિરેન કે શાહ (આસી.મેનેજર) | (ઓફિસ) ૨૯૮૨૩૫૨૫ | મો. ૯૯૭૮૮૩૮૧૪૦ |



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
મહાનગર સેવા સંદર્ભ, દક્ષિણ પશ્ચિમ ઓન - પ્રોપટી ટેક્ષ વિભાગ
જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજીમંદીરની બાજુમાં,
પાણીની ટાંકી સામે, જોધપુર ગામ, અમદાવાદ - ૩૮૦૦૧૫



દક્ષિણ પશ્ચિમ ઓન પ્રોપટી ટેક્ષવિભાગ

પ્રોપટીટેક્ષ વિભાગ

અધિકારીશ્રીનુંનામ

શ્રી મુકેશ બી. પટેલ
ડ.એસેસર એન ટેક્ષ કલેક્ટર
ઈમેલ એડ્રેસ :- mbpatel@ahmedabadcity.gov.in

ટેલીફોનનંબર

૨૯૬૨૩૬૨૫

મોબાઇલ નંબર

૯૩૨૭૦૩૮૮૨૯

શ્રી બિરેન કે શાહ

૨૯૬૨૩૬૨૫

૯૯૭૮૬૩૮૧૪૦

આસી.મેનેજર

ઈમેલ એડ્રેસ birensyah@ahmedabadcity.gov.in

પ્રોફેશન ટેક્ષ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ વિભાગ :-

શ્રી રીલેશ ડોરીયા

૨૯૮૪૧૨૦૪

૯૮૨૪૦૪૮૩૪૯

આસી.મેનેજર

Ext. No. ૧૯૦

ઈમેલ એડ્રેસ:- rilesh@ahmedabadcity.gov.in

કરદાતાઓ તરફથી આવતી નીચે મુજબની અરજીઆનો નિકાલ ટેક્સ ખાતા દ્વારા કરવામાં આવે છે.

- મિલકતની માલિકીના નામ ટ્રાન્સફર અને મિલકતના કબજેદારના નામમાં ફેરફાર કરવા.
 - બી.પી.એમ.સી. એકટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરકૃયુલર નં. ૧૪ મુજબ વપરાશના પ્રકારના ધોરણે મિલકતની આકારણી ઘટાડવા અંગે
 - એકજ મિલકતના બે બિલ આવતા હોય તો વધારાના બિલ રદ કરવા અથવા સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તો વપરાશના ધોરણે જુદા જુદા બિલ કરવા અંગે
 - મિલકત ખાલી/ભીનવપરાશ અંગે નોંધ રાખી ખાલી મિલકતનો ટેક્સ રીફંડ મેળવવા.
 - નવી મિલકતનું એસેસમેન્ટ કે જૂની મિલકતોનો વપરાશ બદલાયો હોય, ભાડાના દરમાં ફેરફાર થયો હોય તો આકારણી રીવાઈઝ કરવા અંગે
 - ખુનિસિપલ વેલ્યુઅશેનઅપીલના ચુકાદાનો અમલ આપવો.
 - ચર્ચુવર્ષિય આકારણીના વર્ષે જાહેરનામાની મુદ્દતમાં વાંધા અરજીઓ સ્વીકારી અપેલેટ ખાતા દ્વારા તેનો પુરાવાના આધારે, સ્થળ તપાસ કરી નિકાલ કરવામાં આવે છે.
૧. નવી મિલકતોની આકારણી અથવા આકારણી રીવાઈઝ કરવા માટે
- નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર ભાડુઆતના ધોરણે વપરાશ કરવામાં આવતો હોય તેમજ વપરાશમાં ફેરફાર થયેલ હોય તો આકારણી રીવાઈઝ કરાવવા માટે ખુનિસિપલ કોર્પોરિશને નક્કી કરેલ ફોર્મમાં અરજી સાથે
- 1) રહેઠાણ માટે મિલકતના માલિકીના પુરાવાની પ્રમાણિત નક્કા, જમીન માલિકીનો ૭/૧૨ નો ઉતારો, ઓર્ગેનાઈઝર પાસેથી કબજો મેળવ્યો હોય તો તેની કબજી પહોંચની પ્રમાણિત નક્કા, રેશનકાર્ડ, ગેસ કનેક્શનના પુરાવા તથા
 - 2) બીનરહેઠાણ માટે ગુમાસ્તાધારાનું લાઈસન્સ, સેલ્સ ટેક્સ રજીસ્ટ્રેશનની પ્રમાણિત નક્કા, વીજળીનું બીલ, ટેલિફોનનું બીલ રજૂ કરવા.
૨. જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બિલો રદ કરાવવા માટે
- જૂની મિલકત જમીનદોસ્ત કયારે થઈ તેના પુરાવા, જૂની મિલકત તોડી પાડ્યા અંગેની અરજી આપેલ હોય તો તેની પહોંચની ઝેરોક્ષ, નવી મિલકત બાંધવા અંગે ખાનની વિગત, બી.પુ.પરમીશન કયારે આપવામાં આવી છે તેની વિગત, નવી મિલકતની આકારણી ટેક્સ ખાતા દ્વારા ક્યા વર્ષથી કરવામાં આવી છે તેની વિગત, રદ કરવાના બિલોની ઝેરોક્ષ નક્કા નક્કા સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.
૩. સમગ્ર મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે
- સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તેના બદલે જગાના વપરાશ મુજબ મિલકતના ભાગલા પાડીને તે મુજબ ટેક્સના બિલ મેળવવા માટે, અરજી ફોર્મ સાથે બિલની પ્રમાણિત નક્કા, ભાડુઆત તાબે મિલકતના ભાડાના પુરાવામાં ભાડા કરારની પ્રમાણિત નક્કા રજૂ કરવી.
૪. મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે
- અરજી ફોર્મ સાથે જૂના ભાડુઆત મિલકત ખાલી કરી ગયાનો પુરાવો / કબજો સૌંઘાનો પત્ર /કબજી કરારની નક્કા, નવા ભાડુઆતનો ભાડા કરાર, ભાડુઆત ખાલી કરી ગયા હોય તો તે અંગે અ.મ્યુ.કોર્પો. ને જાણ કર્યા અંગે અગાઉ અરજી કરેલ હોય તો અરજી કાર્ડની નક્કા, પ્રોપર્ટી ટેક્સના છેલ્લા બિલની નક્કા સામેલ રાખી નિયત ફોર્મમાં અરજી કરવાની છે.
૫. મિલકત ખાલી / ભીનવપરાશ (નોન યુઝ) અંગેની નોંધ રાખવા માટે:
- જે તે નાણાંકિય વર્ષમાં અરજી સાથે પ્રોપર્ટી ટેક્સના બિલની નક્કા રજૂ કરવાથી, જે તે નાણાંકિય વર્ષમાં મિલકત ૩૦ દિવસ કરતાં ઓછા સમય માટે ખાલી હશે તો મિલકતવેરાની રકમ મજરે મળી શકશે નહિ. જે દિવસે અરજી આપવામાં આવી હશે તે તારીખથી ખાલીનો લાભ મળી શકશે. દરેક નાણાંકિય વર્ષમાં મિલકત ખાલી રહેવાની હોય તો અગાઉથી અરજી કરવાની છે. વર્ષના અંતે ખાલીનો લાભ આપવામાં આવે છે.

૬. ભૂનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ કરવા માટે ભૂનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાની પ્રમાણિત નકલ રજૂ કરવી. છેલ્લા બિલની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.
૭. એક જ મિલકતના બે બિલ આવતાં હોય તો વધારાનું બિલ રદ કરવા બાબત. અરજી સાથે ચાલુ બિલ તથા રદ કરવાના બિલની પ્રમાણિત નકલ સામેલ કરી નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.
૮. બી.પી.એમ.સી. એકટની કલમ ૪૮૫/૧, રૂલ-૨૦ તથા સરક્યુલર નં. ૧૪ મુજબ મિલકતની આકારણી ઘટાડવા માટે નવી ફોર્મ્યુલા અમલમાં આવ્યા બાદ નીચેનામાંથી કોઈપણ ફેક્ટરમાં ફેરફાર થાય તો ૪૮૫/૧ મુજબ ભૂ.કોપોરિશનને અરજી કરવાથી ટેક્સમાં ફેરફાર કરી આપવામાં આવે છે. કારપેટ એરીયા: કોઈપણ મિલકતમાં કારપેટ એરીયામાં ફેરફાર હોય તો તે અંગે નિયત ફોર્મમાં અરજી કરવાથી સ્થળ તપાસના આધારે ફેરફાર કરી આપવામાં આવશે. ફેક્ટર-૨ મિલકતના બાંધકામના વર્ષમાં ફેરફાર હોય તો ટેક્સમાં ફેરફાર થાય. અરજદાર બાંધકામ વર્ષના પુરાવા સાથે અરજી આપે તો સ્થળ તપાસ કરી ટેક્સ ઘટાડી આપવામાં આવશે. ફેક્ટર-૩ મિલકતના ઉપયોગ આધારિત ફેરફાર થાય તો જરૂરી પુરાવા રજૂ કરેથી અરજી કરવાથી ટેક્સ ઘટાડી આપવામાં આવે છે. ફેક્ટર-૪ માલિકી સંબંધિત ફેક્ટરમાં એટલે કે ભાડવાતમાંથી માલિક થતા હોય પુરાવા સાથે અરજી કરવાથી તે મુજબ ફેક્ટરમાં ફેરફાર કરી આપવામાં આવે છે.
૯. મિલકતના નામ ટ્રાન્સફર માટે અરજી સાથે નામ ટ્રાન્સફર કરવા માટે સિટી સર્વેની પ્રમાણિત નકલ, જો મિલકત રજીસ્ટર્ડ કો.ઓ.હા.સોસાયટીમાં હોય તો પોશેન લેટર અને શેર ટ્રાન્સફરના ઠરાવની ચેરમેન અથવા સેક્ટરીની સહી સિક્કાવાળી પ્રમાણિત નકલ, અથવા રજીસ્ટર્ડ દસ્તાવેજ અથવા ઈન્દેક્શની નકલ., અથવા કન્વેયન્સ ડિડની પ્રમાણિત નકલ જેના નામે મિલકત ટ્રાન્સફર કરવાની છે તેઓની અરજી ફોર્મના કોલમ નં.૮ માં મિલકત ખરીદનાર બધાની સહી કરાવવી રજૂ કરવાથી કરી આપવામાં આવશે. આ મિલકતનો અરજી કર્યા તારીખ સુધીનો પૂરેપૂરો તમામ ટેક્સ ભરી પહોંચની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની છે.

ક્રમાંક નં. ૧ થી ૮ ના દરેક ફોર્મની કિમત રૂ. ૨-૦૦ રાખવામાં આવેલ છે તથા અરજીની સાથે સામેલ કરવામાં આવતા પુરાવાઓની નકલ પ્રમાણિત કરેલી આવશ્યક છે.
(અ.ભૂ.કો.ના પુરાવા જેવાકે ટેક્શનનું બીલ, નાણાં ભર્યાની રસીદ વિગેરેને પ્રમાણિત કરાવવી આવશ્યક નથી)

- ❖ જાહેરનામાના અનુસંધાનમાં ભૂનિસિપલ મિલકતવેરાના આકારણી અંગે વાંધા અરજી કરવા માટે દર વર્ષે ભૂનિસિપલ કોપોરિશન દ્વારા ટેક્સના બિલ ઈસ્યુ કરતા પહેલા જાહેરજનતા પોતાની મિલકતનો ટેક્સ કેટલો છે તે જાણી શકે તે માટે ૧૫ દિવસ સુધી એસેસમેન્ટ રજીસ્ટરો જોવા માટેની જાહેરાત બે વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે. નાગરિકો વિનામૂલ્યે આવી નોંધ જોઈ શકે છે, તેનો ઉતારો કરી શકે છે અને નોંધ કે ટેક્સ સામે કોઈ વાંધો હોય તો પુરાવા સાથે નિયત ફોર્મમાં નિયત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. વાંધા અરજીના નિકાલ માટે એપેલેટ ઓફિસર ઉપરોક્ત અરજીની સુનાવણી કરી નિકાલ કરશે. એપેલેટ ઓફિસરના હુકમથી સંતોષ ન હોય તો આવો હુકમ મળ્યાના ૧૫ દિવસની અંદર સ્મોલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. બિલ સામે ફરિયાદ કરી શકાતી નથી.
- ❖ ખાસ નોટિસ સામેની વાંધા અરજી અંગે હુકમ મિલકતમાં કોઈ વધારાના બાંધકામના સમયે કે મિલકતનો વપરાશ માલિક તાબેથી ભાડુઆત તાબે થાય કે રહેઠાણમાંથી બીજારહેઠાણમાં વપરાશ બદલાવવાના લીધે ચાલતો ટેક્સ વધારવાના સમયે કારણોની

વિગત સાથે મિલકત ધારકને ખાસ નોટીસ આપવામાં આવે છે. સદરહુ નોટિસ મજ્યાના ૧૫ દિવસમાં વાંધાના કારણો - પૂરાવા સાથે વાંધા અરજી કરી શકાય અને અને આવી વાંધા અરજીનો નિકાલ જાહેરનામાના સંદર્ભમાં કરવામાં આવેલ વાંધા અરજીના નિકાલની જેમજ એપેલેટ ઓફિસર દ્વારા કરવામાં આવે છે.

❖ મિલકત વપરાશ / પુનઃ વપરાશ સમયે કરવાની ફરજીયાત જાણા:

કોઈપણ નવી મિલકત કે જૂની બંધ મિલકતનો પુનઃ વપરાશ શરૂ કર્યાના ૧૫ દિવસમાં ખુનિસિપલ કોપેરિશનમાં બી.પી.એમ.સી. એકટના પરિશિષ્ટ એ ના પ્રકરણ-૮ ના રૂલ ૫ હેઠળ જાણ કરવી ફરજીયાત છે. નિયત કરવામાં આવેલ રીકવીઝીશન ફોર્મ ખુનિસિપલ કોપેરિશનની ઝોનલ કચેરીઓના ટેક્સ વિભાગમાંથી વિના મૂલ્યે મળી શકશે. સમયમર્યાદામાં મિલકતના વપરાશ કે મિલકતમાં થયેલ વધારાના બાંધકામ, બદલાયેલ ઉપયોગના પ્રકાર કે ભાડુઅાત અંગે જાણ કરવામાં ન આવે તો આવી મિલકતોનો ટેક્સ, ટેક્સ ખાતા દ્વારા પુરાવાના અભાવે કરવામાં આવે છે અને બી.પી.એમ.સી. એકટ પરિશિષ્ટ-એ ના પ્રકરણ ૮ ના રૂલ ૮(૩) ની જોગવાઈ મુજબ આવા ટેક્સ સામે વાંધો લેવાને મિલકતના માલિક અથવા ભોગવટો કરનારને પ્રતિબંધ નડશે.

અરજી નિકાલની સમય મર્યાદા :-

તમામ પૂરાવાઓ અરજી સાથે આપેલા હોય અને નવી ગણતરી મુજબ પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ હોય તો અરજીનો નીચે જણાવેલ સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવશે.

| અનુ. નંબર | અરજીનો પ્રકાર | અરજીનાનિકાલની સમય મર્યાદા |
|-----------|---|--------------------------------------|
| ૧ | બી.પી.એમ.સી. એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરકૃયુલર નં. ૧૪ મુજબ મિલકતની આકારણી ધટાડવા બાબત | ૧ માસ |
| ૨ | નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર તો જૂની મિલકત ભાડુઆત પાસેથી કરવામાં આવેલ ભાડાના વધારાને લઈ તેમજ વપરાશ ફેરફાર થયેલ હોઈ આકારણી રીવાઈઝ કરવા | ૧ માસ |
| ૩ | મિલકતના કબજેદારમાં ફેરફાર કરવા બાબત | ૧૫ દિવસ |
| ૪ | મિલકતના ઉપયોગના પ્રકારમાં ફેરફાર | ૧૫ દિવસ |
| ૫ | જનીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બિલો રદ કરવા | ૧ માસ |
| ૬ | સમગ્ર મિલકતનું એક બિલ આવે છે તેના બીલો જગાના વપરાશ મુજબ આકારણીના ભાગલા પાડીને તે મુજબ ટેક્સ બિલ આપવા બાબત | ૧ માસ |
| ૭ | એક જ મિલકતના બે બિલ આવતા હોય તો વધારાનું બિલ રદ કરવા | ૧ માસ |
| ૮ | મિલકતના નામ ટ્રાન્સફર માટે | ૧૫ દિવસ |
| ૯ | અન્ય-સામાન્ય અરજીઓ | ૧૫ દિવસ |
| ૧૦ | મિલકત ખાલી / નોન યુઝ અંગે | વર્ષ પૂરું થયા બાદ ૩૦ એપ્રિલ સુધી |
| ૧૧ | ભ્ય. વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ લેવા અંગે | ૧૫ દિવસ |

ઉપરોક્ત પ્રકારની અરજીઓના નિકાલ માટેની લધુતમ સમય મર્યાદા ખાતા દ્વારા નિયત કરવામાં આવેલ છે. જો ઉપરોક્ત સમય મર્યાદામાં અરજીનો નિકાલ ન થાય તો સંબંધિત જોનનાં તેખુટી એસેસર એન્ડ ટેક્સ કલેક્ટરશ્રી નો રૂબરૂ સંપર્ક કામકાજના દિવસોએ ૩-૦૦ થી ૫-૦૦ માં કરવો.

બિલમાં નામ/ સરનામાં (સ્પેલીંગ) અંગેની ભૂલ માટે પુરાવા સાથે સાદા કાગળ ઉપર અરજી કરવાથી તે અંગેનો નિકાલ કરવામાં આવશે.

આવી અરજીઓ કરવા જાહેર જનતાની અનુકૂળતા માટે ખુબજ નજીવી કિમતે છાપેલા ફોર્મ દફ્તર વિભાગ તથા દરેક જોન તથા દરેક સીવીક સેન્ટર ઉપરથી નાગરિકોને ઓફિસ સમયે વેચાણ આપવામાં આવે છે તેમજ ભરેલ ફોર્મ કોઈપણ જોનમાં આપી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે. નીચે મુજબના કેશ કલેક્શન કાઉન્ટરો રાખવામાં આવેલ છે.

બિલ મળ્યાના ૧૫ દિવસમાં જો બિલ ભરવામાં ન આવે તો ટેક્સ બીલમાં જણાવેલ રકમ તેમજ પાછલા વર્ષની બાકી રકમ નિયમ મુજબ કાયદાકીય જરૂરી પગલાં લઈ દંડ સાથે વસુલ કરવામાં આવે છે.

વધીવઠી માળખું

ડ.મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણ પશ્ચિમ ઓન)



આસી.મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણ પશ્ચિમ ઓન)



ડ.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર(દક્ષિણ પશ્ચિમ ઓન)



આસી.મેનેજર



ડિવીઝનલ સુપ્રી.



વોર્ડ ઈન્સપેક્ટર

ફરજનો સમય :

તમામ કામકાજના દિવસોએ સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી ઓફિસ ચાલુ રહેશે. આઉટડોર ફરજ બજાવનાર કર્મચારીઓનો સમય, આઉટડોર ફરજ માટે સવારે ૮:૩૦ થી બપોરના ૧૨:૩૦ સુધી તથા ઓફિસનો સમય બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૧૦ સુધીનો હોય છે.

ઝોનમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટરશ્રી નામ ટ્રાન્સફર, કબજેદાર ફેરફાર માટેની ફાઈલો તૈયાર કરી ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા આસી. મેનેજરશ્રીને ભલામણ કરી તે. એસેસર અને ટેક્ષ કલેક્ટરશ્રી મંજુરી આપે છે.

ઝોનમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટરશ્રી આકારણી ઘટાડવા માટેની ફાઈલો તૈયાર કરી ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા આસી. મેનેજરશ્રીએ કરેલ ભલામણ મુજબ મે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ નીચે જગ્યાવેલ ઓફિસ ઓર્ડર નં. ૧૨/૨૦૧૮-૧૬ તા. ૨૬/૦૮/૨૦૧૮ માં આપેલ સત્તા મુજબ સક્ષમ સત્તા મંજુરી આપે છે.

ટેક્ષ ખાતું:-

| | | |
|---|----|-------------------------|
| - આસી.મેનેજર શ્રી | :- | રૂ. ૨૫,૦૦૦/- સુધી |
| - ડ.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી | :- | રૂ. ૧,૦૦,૦૦૦ /- સુધી |
| - એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી | :- | રૂ. ૨,૦૦,૦૦૦/- સુધી |
| - DY.ATC Committee + ATC + Zonal DY M. C. | :- | રૂ. ૭,૦૦,૦૦૦/- સુધી |
| - DY.ATC Committee + ATC + DYM C કમિટી [ત્રણ DYM C અને DYM C (Tax)] | :- | રૂ. ૨૦,૦૦,૦૦૦/- સુધી |
| - મ્યુનિસિપલ કમિશનરશ્રી | :- | રૂ. ૨૦,૦૦,૦૦૦ /- થી ઉપર |

દક્ષિણ પશ્ચિમ ઓન – સીટી સિવિક સેન્ટર

| ક્રમ | સેન્ટર | સરનામું | ફોન નંબર |
|------|----------|---|----------------------|
| ૧. | વેજલપુર | જલતરંગ પોલીસ સ્ટેશન, જલતરંગ બસ સ્ટેન્ડ પાસે, વેજલપુર | ૨૯૮૯૩૨૭૮ ૨૯૮૯૩૩૭૮ |
| ૨. | જોધપુર | રામજી મંદિરની પાસે, જુની નગરપાલિકા ઓફિસ, જોધપુર ગામ | ૨૯૬૨૪૫૩૩ |
| ૩. | સરખેજ | સરખેજ વોર્ડ ઓફિસ, જુની નગરપાલિકા ઓફિસ, પાણીની ટાંકી પાસે, સરખેજ | ----- |
| ૪. | મકતમપુરા | APMC માર્કેટની બાજુમાં, વિશાળા સર્કલ પાસે, અમદાવાદ | ----- |



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સંદર્ભ, દક્ષિણ પશ્ચિમ ઓન - પ્રોપર્ટી ટેક્ષ વિભાગ
જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજીમંદીરની બાજુમાં,
પાણીની ટાંકી સામે, જોધપુર ગ્રામ, અમદાવાદ - ૩૮૦૦૧૫



દક્ષિણ પશ્ચિમ ઓન

પ્રોપર્ટી ટેક્ષ વિભાગના કર્મચારીઓની માહિતી(માહે જુલાઈ-૨૦૧૮ પગારબીલ મુજબ)

| અ.નં. | અધિકારી/કર્મચારીનુંનામ | એપ્લોઈંગ નં. | હોદ્ડો | ગ્રેડ |
|-------|--------------------------|--------------|---------------------------|--------------|
| ૧ | શ્રી મુકેશ બી. પટેલ | ૭૨૨૭૭ | ડે.એસે.એન્ડ ટેક્સ કલેક્ટર | ૫૭૭૦૦-૨૦૮૭૦૦ |
| ૨ | શ્રી બિરેન કે શાહ | ૮૫૯૨ | આસી.મેનેજર | ૫૩૧૦૦-૧૫૭૮૦૦ |
| ૩ | શ્રી પરસોત્તમભાઈ એફ રાણા | ૮૫૫૫ | ઓફિસ સુપ્રી. | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૪ | શ્રી નિલેશભાઈ એન. પરીખ | ૮૬૫૬ | ઓફિસ સુપ્રી. | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૫ | શ્રી રમેશ ડી ગોહીલ | ૮૪૭૩ | ડીવી.સુપ્રી. | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૬ | શ્રી નરસીંહભાઈ ડી ભગોરા | ૮૬૦૩ | ફેડ કલાક | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૭ | શ્રી રેણુયાર નંદકુમાર આર | ૮૮૨૧ | વોડ ઇન્સ્પેક્ટર | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૮ | શ્રી નરેશભાઈ ચંચલાણી | ૭૬૬૩ | વોડ ઇન્સ્પેક્ટર | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૯ | શ્રી હર્ષાબેન એ.જોગી | ૮૭૫૨ | વોડ ઇન્સ્પેક્ટર | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૧૦ | શ્રી આરતીબેન મહેન્દુ | ૮૭૨૮ | વોડ ઇન્સ્પેક્ટર | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૧૧ | શ્રી ડિપ્પલ મોદી | ૩૪૬૧૫ | વોડ ઇન્સ્પેક્ટર | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૧૨ | શ્રી રવિન્દ ગામીત | ૪૨૦૪૩ | વોડ ઇન્સ્પેક્ટર | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૧૩ | શ્રી અનીલ વસાવા | ૪૨૦૧૬ | વોડ ઇન્સ્પેક્ટર | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૧૪ | શ્રી ઈલેશ રાઠોડ | ૮૫૨૦ | સીની.કલાક | ૩૪૪૦૦-૧૧૨૪૦૦ |
| ૧૫ | શ્રી રમણભાઈ કે રાઠોડ | ૮૬૦૮ | ઇન્યાર્જ વો.ઇ.અને જુ.કલાક | ૨૫૫૦૦-૮૧૧૦૦ |
| ૧૬ | શ્રી ચેતનભાઈ વણોલ | ૪૨૫૩૫ | ઇન્યાર્જ વો.ઇ.અને જુ.કલાક | ૧૬૬૦૦-૫૩૨૦૦ |
| ૧૭ | શ્રી સુજલ શાહ | ૭૨૮૫૧ | ઇન્યાર્જ વો.ઇ.અને જુ.કલાક | ૧૬૬૦૦-૫૩૨૦૦ |
| ૧૮ | શ્રી જયશ્રીબેન ડી.ઓ.આ | ૭૨૪૮૬ | જુની.કલાક | ૧૬૬૦૦-૫૩૨૦૦ |

| | | | | |
|----|---------------------------------|-------|------------------------------------|-------------|
| ૧૯ | શ્રી સંજય કલસરીયા | ૪૬૭૭૮ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૦ | શ્રી અલ્પેશ કે.રાઠોડ | ૪૬૭૯૪ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૧ | શ્રી કૌશીક બી.ચૌધારી | ૪૬૮૧૬ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૨ | શ્રી ભાવિક એન.જાની | ૪૬૮૨૧ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૩ | શ્રી રઘુવીરસિંહ મકવાણા | ૪૬૭૯૮ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૪ | શ્રી દીપેશ પરમાર | ૪૬૭૯૯ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૫ | શ્રી પાર્થ બી.પ્રજાપતી | ૪૬૮૧૫ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૬ | શ્રી સંજય એસ.પટેલ | ૪૭૧૯૨ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૭ | શ્રી જ્યેશ આઈ. પટેલ | ૪૬૭૩૧ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૮ | શ્રી કાનજુ કે.ચૌધારી | ૪૬૮૧૭ | ઈન્યાર્જ વો.ઇ.અને સહાયક જુ.કલાક | ૧૬૫૦૦ |
| ૨૯ | શ્રી બારિયા બાબુભાઈ મનસુખભાઈ | ૧૭૩૫ | કેડક્ટર | ૧૬૬૦૦-૫૩૨૦૦ |
| ૩૦ | શ્રી ભાભોર દલસુખભાઈ ડી. | ૨૦૪૭ | કેડક્ટર | ૧૬૬૦૦-૫૩૨૦૦ |
| ૩૧ | શ્રી ભીમાજુ વી ઠાકોર | ૮૧૫૧૪ | પટાવાળા | ૧૪૮૦૦-૪૪૧૦૦ |
| ૩૨ | શ્રી રાહુલ એમ નાગબોધી | ૩૫૩૧૮ | પટાવાળા | ૧૪૮૦૦-૪૪૧૦૦ |

દક્ષિણ પશ્ચિમ ઓન – પ્રોપરી ટેક્સ વિભાગ

| અનુ.નંબર | વોર્ડ નંબર | વોર્ડનું નામ | વોર્ડ ઇન્સ્પેક્ટરનું નામ |
|----------|---------------|-----------------------|--------------------------|
| ૧ | ૦૭૨૫ | વલાપુર રેલ્વે સ્ટેશન | શ્રી સંજયપટેલ |
| ૨ | ૦૭૨૬ | શ્યામલ ચાર રસ્તા | શ્રી સંજય કલસરીયા |
| ૩ | ૦૭૨૭ | રામદેવ નગર | શ્રી દલસુખ ભાભોર |
| ૪ | ૦૭૨૮ | પ્રહલાદનગર ગાર્ડન | શ્રી સુજલ શાહ |
| ૫ | ૦૭૨૯ | જીવરાજ પાર્ક | શ્રી અલ્પેશ રાહોડ |
| ૬ | ૦૭૩૦ | ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ | શ્રી કૌશીક ચૌધરી |
| ૭ | ૦૭૩૧ | વેજલપુર | શ્રી ચેતન વણોલ |
| ૮ | ૦૭૩૨ | શ્રીનંદ નગર | શ્રી હર્ષાબેન જોગ્યી |
| ૯ | ૦૭૩૩ | સોનલ સીનેમા રોડ | શ્રી રમણ કે. રાહોડ |
| ૧૦ | ૦૭૩૪ | જલતરંગ સોસાયટી | શ્રી ભાવિક જાની |
| ૧૧ | ૦૭૩૫ | યુનીયન પાર્ક | શ્રી બાબુભાઈ બારીયા |
| ૧૨ | ૦૭૩૬ | ફેવાડી ટાવર | શ્રી કાનજી ચૌધરી |
| ૧૩ | ૦૭૩૭ | સરખેજ | શ્રી રઘુવીરસિંહ મકવાણા |
| ૧૪ | ૦૭૩૮ | ઉજાલા સર્કલ | શ્રી અનીલ વસાવા |
| ૧૫ | ૦૭૪૮ | ફેવાડી | |
| ૧૬ | ૦૭૪૯ | વણજર | |
| ૧૭ | ૦૭૫૦ | બાદરાબાદ | |
| ૧૮ | ૦૭૫૧ | નરીમાનપુરા | |
| ૧૯ | ૦૭૫૪ | બાકરોલ | |
| ૨૦ | ૦૭૫૩ | મકતમપુરા | શ્રી પાર્થ પ્રજાપત્ની |
| ૨૧ | ૦૭૮૧ | મકરબા | શ્રી નરેશ ચંચલાણી |
| ૨૨ | ૦૭૪૮ | શીવરંજની સોસાયટી | શ્રી ડિમ્પલ મોદી |
| ૨૩ | ૦૭૪૬ | સત્યાગ્રહ છાવણી | શ્રી આરતી મહેન્દુ |
| ૨૪ | ૦૭૫૦ | પ્રેરણાતીર્થ | શ્રી રવિંદ્ર ગામીત |
| ૨૫ | ૦૭૫૧ | ગોકુલ આવાસ | શ્રી ડિમ્પલ મોદી |



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

મહાનગર સેવા સંદર્ભ, દક્ષિણ પદ્ધિમ ઝોન - પ્રોપર્ટી ટેક્ષ વિભાગ
જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજીમંડીરની બાજુમાં,
પાણીની ટાંકી સામે, જોધપુર ગામ, અમદાવાદ - ૩૮૦૦૧૫



દક્ષિણ પદ્ધિમ ઝોન

પ્રોફેશનલ ટેક્ષ વિભાગના કર્મચારીઓની માહિતી

| અ.નં. | એમ્પ્લોઈ નંબર | અધિકારી/કર્મચારીનું નામ | હોદ્દો | ગ્રદ |
|-------|------------------|-------------------------|----------------------|--------------|
| ૧. | ૭૩૧૭૩ | શ્રી રીલેશ ડોરીયા | આસી.મેનેજર | ૫૩૧૦૦-૧૬૭૮૦૦ |
| ૨. | ૮૫૮૭ | શ્રી કોશીક છ. પટેલ | ઓફિસ સુપ્રિ. | ૪૪૬૦૦-૧૪૨૪૦૦ |
| ૩. | ૭૨૮૭૯ | શ્રી કલ્પેશ બી. કદમ | ફેડ કલાર્ક | ૩૫૪૦૦-૧૧૨૪૦૦ |
| ૪. | | શ્રી દશરથભાઈ છ. પરમાર | સહાયક સીની.કલાર્ક | ૨૫૫૦૦-૮૧૧૦૦ |
| ૫. | ૭૨૮૧૪ | શ્રી પ્રભાબેન એ. ચાવડા | જુની. કલાર્ક | ૨૫૫૦૦-૮૧૧૦૦ |

આર.ટી.આઈ એક્ટ અન્વયે દક્ષિણ પદ્ધિમ જોન - પ્રોપર્ટી ટેક્ષ વિભાગની માહિતી

| (૧) | સંબંધિત બીટ માટે જાહેર માહિતી અધિકારીશ્રીનું નામ અને હોદ્દો | સરનામું | ઇ-મેઈલ એડ્રેસ ટેલીફોન નંબર | (૨) | અપીલ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો | સરનામું | ઇ-મેઈલ એડ્રેસ ટેલીફોન નંબર |
|-----|--|--|--|-----|---|---|--|
| ૧. | શ્રી પરખોત્તમ એફ રાણા ઓફિસ સુપ્રિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ (ઓન લેવલની માહિતી માટે) | જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજી મંદિરની બાજુમાં, પાણીની ટાંકી પાસે, જોધપુર | swztax@ahmedabadcity.gov.in ૨૬૯૨૩૯૨૫ | ૧. | શ્રી મુકેશ બી. પટેલ ડ.એસેસર એન્ડ ટેક્ષ કલકટર | જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજી મંદિરની બાજુમાં, પાણીની ટાંકી પાસે, જોધપુર | mbpatel@ahmedabadcity.gov.in ૨૬૯૨૩૯૨૫ |
| ૨. | શ્રી નિલેશ એન.પરીખ ઓફિસ સુપ્રિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ (વોડ લેવલની માહિતી માટે) | જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજી મંદિરની બાજુમાં, પાણીની ટાંકી પાસે, જોધપુર | swztax@ahmedabadcity.gov.in ૨૬૯૨૩૯૨૫ | ૨. | શ્રી બિરેન કે શાહ. આસી.મેનેજર | જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજી મંદિરની બાજુમાં, પાણીની ટાંકી પાસે, જોધપુર | birensyah@ahmedabadcity.gov.in ૨૬૯૨૩૯૨૫ |
| ૩ | શ્રી રીલેશ ડોરીયા આસી.મેનેજર- વ્યવસાય વેરા વિભાગ | રાજમાતા વિજયારાજે સિંધિયાભવન, અતિથિ હોટલની બાજુમાં, બોડકદેવ | rilesh@ahmedabadcity.gov.in ૨૬૮૪૧૨૦૪ Ext. No.૧૯૦ | ૩. | શ્રી મુકેશ બી. પટેલ ડ.એસેસર એન્ડ ટેક્ષ કલકટર | જોધપુર ગ્રામ પંચાયત ઓફિસ, રામજી મંદિરની બાજુમાં, પાણીની ટાંકી પાસે, જોધપુર | mbpatel@ahmedabadcity.gov.in ૨૬૯૨૩૯૨૫ |